

#### **Tatva Chintan Pharma Chem Limited**

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) (CIN:L24232GJ1996PLC029894)



Date: 05 November 2022 Ref No.: TCPCL/SEC/2022-23/00073

To,

The General Manager, Corporate relationship department, BSE Limited

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai-400 001

**Scrip Code: 543321** 

The Manager,
Listing department,
National Stock Exchange of India Limited
Exchange Plaza C. 1. Plack C.

Exchange Plaza, C-1, Block-G, Bandra-Kurla, Complex Bandra(E),

Mumbai-400 051

**Scrip Symbol: TATVA** 

#### Subject: Newspaper Publication of extract of financial results of the Company

Dear Sir/Madam,

Pursuant to regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, we are enclosing herewith copies of newspaper publication of extract of financial results of the Company for the quarter and half year ended 30 September 2022, published in Financial Express (English edition) and Vadodara Samachar (Gujarati edition) on 05 November 2022.

The above information shall be made available on the website of the Company at www.tatvachintan.com.

Kindly take the same on record and disseminate to the public at large.

Thanking You,

Your Faithfully,

For Tatva Chintan Pharma Chem Limited

Ishwar Digitally signed by Ishwar Ramanbhai Nayi

Nayi Date: 2022.11.05 11:32:04 +05'30'

Ishwar Nayi

**Company Secretary and Compliance Officer** 

M. No.: A37444

Encl: As above

**Brent** Intra-day, November 4 (\$ bbl)

LAURA SANICOLA November 4

**OIL PRICES ROSE** by more than \$4 on Friday before paring some gains amid uncertainty around future interest rate hikes by the US Federal Reserve, while a looming EU ban on Russian oil and the possibility of China easing some COVID restrictions supported markets.

Though fears of global recession capped gains, Brent crude futures were up \$2.63, or 2.8%, at \$97.30 a barrel by 12:08 pm EDT (1608 GMT), set for a weekly gain of about 2.5%.

US West Texas Intermediate (WTI) crude futures were up \$2.96, or 3.4%, at \$91.13 and on course for a weekly gain of nearly 5%.

China is sticking to its strict COVID-19 curbs after cases rose on Thursday to their highest since August, but a former Chinese disease control official said substantial changes to the

country's COVID-19 policy are to take place soon.

China's stock markets have been buoyed this week by the rumours of an end to stringent lockdowns despite the lack of any announced changes.

However, signals about the size of U.S. interest rate hikes caused oil to pare some gains.

The US Labour Department's non-farm payrolls report on Friday showed a rise in the unemployment rate to 3.7% last month from 3.5% in September, suggesting some loosening in labour market conditions that could give the Fed cover to shift towards smaller rate increases.

Richmond Federal Reserve president Thomas Barkin on Friday said he is ready to act more "deliberatively" on consideration of the pace of future U.S. interest rate hikes, but said rates could continue rising for longer and to a higher end point than previously -REUTERS expected.

A Republican

Chris Wood

**ASHLEY COUTINHO** 

Mumbai, November 4

THE DECLINE IN the FANNGM

(Facebook, Apple, Netflix,

Nvidia, Google, Microsoft)

stocks as a percentage of

S&P500 market capitalisation

probably has much further to

run, partly because of Apple,

which now has the greatest

downside risk on the last man

standing theme, said Christo-

pher Wood, global head of

equity strategy at Jefferies in

his recent note to investors,

fallen 55% each in the year to

date. Facebook's parent Meta

Platforms is down 74%, while

Google parent Alphabet has

shed 43%. Microsoft and

Apple have slid 36% and

Tech stocks last week came at

the same time as Exxon Mobil

hit an all-time high on the

release of its third quarter

earnings. Wood characterised

this as "the revenge of the

physical"theme after the orgy

in digitalia triggered by the

de-rating is clearly the impact

of rising discount rates on

lofty valuations, investors

"If the catalyst for Big Tech

The capitulation in Big

23.7%, respectively.

pandemic.

Nvidia and Netflix have

GREED & Fear.

takeover of Congress would render unlikely renewed agaressive fiscal stimulus in the

context of a gridlocked Washington

CHRISTOPHER WOOD, GLOBAL HEAD OF **EQUITY STRATEGY, JEFFERIES** 

should also remember the potential for the unwinding of passive driven investment strategies. This ongoing process can be seen in the peaking out of S&P500 index ETFs and the subsequent, albeit so far moderate, decline," said Wood.

**RAJESH KURUP** Mumbai, November 4

Tech stocks may RCap CoC can't decide on fall further, says challenge mechanism

THE COMMITTEE OF creditors (CoC) of Reliance Capital (Rcap), which met on Friday, was unable to decide on the format of the proposed 'challenge mechanism' and decided to take the call later. While the lenders want the mechanism to be added in the bidding process, a consensus was yet to be arrived on the process, sources close the development said.

The advisors to the bankruptcy process had suggested multiple options under the challenge mechanism, including the 'Swiss Challenge Process'where the highest bidder would be declared as an

anchor bidder and will have the right of first refusal (RoFR). Other options included negotiations with CoC by bidders, electronic auction to declare the highest bidder or combination of these. This would mean that the bidders would have to submit the resolution plans without"enough"information

"The bidders are in complete darkness on how this process will work," a source close to the development said, adding this might result in bids being placed at much lower valuations.

on the proposed process.

The CoC also wants the bidders to provide a written consent stating they will participate in the challenge

challenge mechanism mechanism, even if it is implemented at a later stage.

The bidders had earlier raised concerns over introduction of the 'challenge mechanism', which gave power to lenders to challenge any resolution plan as and when they want. Further, this was added later as there was no mention of this clause in the request for resolution plan (RFRP) and the CoC had not clearly spelled out the contours of the clause.

According to certain bidders, the clause is also being added at a time when the former Anil Ambani group firm's insolvency process was inching towards a closure, with the deadline to complete it ending on January 31.

## Chola eyes 25% AUM growth

SAJAN C KUMAR Chennai, November 4

of FY23.

CHOLAMANDALAM INVEST-**MENTAND** Finance Company (Chola), the financial services arm of Murugappa group, has said it expects a growth of 20-25% in its assets under management (AUMs) for the current financial year. The company believes that it can achieve a disbursement growth of 25-30% by the end bursement growth in Q2 as well as in the first half of FY23. Aggregate disbursements in the September quarter stood at ₹14,623 crore, against ₹8,706 crore, registering a growth of 68%. For the first half, disbursements were at ₹27,953 crore, compared with ₹12,341 crore, a growth of 127%.

Chola reported a robust dis-

Chola had recorded a 36% iump in disbursements to ₹35,489 crore for FY22, against ₹26,043 crore in FY21.

Arul Selvan D, president & CFO, told FE that the company expects a disbursement growth of 25-30% by the end of the current fiscal. He believes that the demand for vehicles will continue in the second half as the monsoon has been good, resulting in better rural income which will auger well for its vehicle finance vertical. He said disbursements will be robust, and accordingly the AUM level will reflect the overall growth.

### City Union Bank PAT soars 52% to ₹276 cr

**CITY UNION BANK** (CUB) on ago period. Total income stood Friday registered a 52% rise in its profit after tax (PAT) to ₹276 crore for the second quarter of FY23, compared with ₹182 crore in the year-

Can Messi help

Byju's dribble

past its layoff

controversies?

at ₹1,355 crore, compared to ₹1,225 crore, logging a growth

The bank earned a net interest income of ₹568 crore

as against ₹478 crore, with a growth rate of 19%. However, the non-interest income was lower at ₹173 crore as against ₹203 crore.

—FE BUREAU

### FROM THE FRONT PAGE

customers are smart, and they will see right through this strategy that placed ego above doing what is right." Some, however, say Byju's has done the right thing. Says

"THE GLOBAL celebrities did precious little for the brands. Brosnan raked up a fair bit of controversy, with the actor claiming he had no idea he was promoting a 'betel brand'. Micromax used Jackman to signal its global ambitions and then sank without a trace. Both associations were stretched and a total waste of (lots of) money." Alessandro Giuliani, man-

aging director, SDA Bocconi Asia Center, thinks such associations are a hazard given that the life span of such endorsements is very short.

"With Messi, it could get worse," says Azaan Sait of The Hub Bengaluru. "In my opinion, the brand could have invested the money to retain

DSTWAL

and upskill their team. Today's

Shashank Sharma, co-founder & CEO of Expedify, "Byju's has been eyeing rapid expansion outside India and there are few celebrities who are as universally loved as Messi. He also exemplifies'learning', which is the central value proposition for Byju's. And now with the rise of football viewership in India that will see a huge jump during the upcoming FIFA World Cup, the timing couldn't

have been better." Indeed, hiring global celebrities assures a very large reach and spike in attention, says Giuliani of SDA Bocconi

Asia Center. "The fact that we're talking about this means that it has generated buzz, confusion and hype in the market," adds Sait

of The Hub Bengaluru. **KV Kamath** named RIL independent

director

SO MUCH so that Dhirubai's widow, Kokilaben, requested him to broker peace between her warring sons in 2004, two years after the patriarch's death. It was Kamath, along with another friend of Dhirubhai and merchant banker Nimesh Kampani, who drafted a new ownership structure that was accepted by both brothers.

The appointment comes months after Mukesh Ambani stepped down as director of RIL's telecom arm, Reliance Jio Infocomm, handing over the reins to his son Akash.

RSIL, which will be renamed JFSL, is a non-deposit taking systemically important non-banking financial com-

pany (NBFC). RIL approved the subsidiary's demerger in October. RIL shareholders will receive a share of JFSL for a share of RIL as per the scheme. The NBFC plans to provide adequate regulatory capital for lending and initiate other financial services verticals such as insurance, payments, digital broking, and asset management in three years.

### Weak volumes at consumer firms hint at slow

recovery

"THE GROWTH appears more disappointing as the Indian economy was already witnessing a broad slowdown in the base period. It is interesting to see the weak growth of staples, which would suggest a disproportionate impact of Covid-19 pandemic on low-income households. They appear to have reduced usage, downtraded to cheaper products and migrated to unbranded projects from the unorganised sector," analysts at KIE wrote.

While GST collections for the seven months to October have gone up by 14.1% on a three-year CAGR basis, the average wholesale price index has risen at a three-year CAGR of 8.2% in the first six months of FY23. While the formalisation of the economy has no doubt boosted GST collections, analysts point out they have also been supported by high inflation. As such, the numbers could be masking weak volume growth.

Several firms have trimmed expenses on advertising and promotions (A&P) to arrest the fall in operating margins. Although gross margins at HUL contracted nearly 600 basis points y-o-y, the lower A&P spends which were down 250 bps y-o-y, helped the company defend the operating profit margins at 22.9%.

Dabur's Malhotra observed that on account of continued unprecedented material inflation, the gross margins contracted by 300 bps plus. "This was partially offset by price increases and saving initiatives and led to operating margins declining by around 190 bps to touch 20.1%," Malhotra said.

Gross margins at Colgate fell 310 bps y-o-y, the cut in ad spends by nearly 15% y-o-y helped the company report an Ebitda margin of 29.4%.

### Amid global job cuts, Twitter sacks most of its India team

SEVERAL BRANDS have paused their advertising plans with the platform since Musk

took over. Apart from engineeringrelated departments, the India set-up comprises marketing, communications, events, and

strategic tie-up teams. Last year, after a long tussle

with the government over appointing a set of officers to look into grievance redressal of users under the new Information Technology Rules, Twitter had decided against appointing a country director for India operations. The social media firm had decided to put in place a leadership council for India operations, which comprised its key executives who reported to Twitter's overseas executives.

Manish Maheshwari who was the country director for India then was moved to US from where he later quit the company.

Musk began his innings at Twitter last week by firing the CEO Parag Agrawal as well as the CFO and some other top executives. This was followed by an exodus of top management. He has now started a massive exercise to downsize the company's global workforce.

The US-based social media platform, in an internal email to employees earlier, had said, "In an effort to place Twitter on a healthy path, we will go through the difficult process of reducing our global workforce on Friday." It said "everyone will receive an individual email".

The company temporarily closed all offices for the safety of employees and Twitter systems and customer data. "If you are in an office or on your way to an office, please return home,"Twitter had said.

While Twitter has had several run-ins with the government over freedom of speech, the company in the email barred employees from discussing confidential company information on social media, with the press or elsewhere.

The company is reportedly laying off 3,738 people out of its total headcount of 7,500 across the globe.

# MADHYA BHARAT AGRO PRODUCTS LTD.

Reg. Office- 5-O-21, Basement, R.C. Vyas Colony, Bhilwara (Raj.) India Website: www.mbapl.com Email: secretarial@mbapl.com;

CIN: L24121RJ1997PLC029126, Tel. No.: 01482-237104, Fax No.: 01482-239638

Extract of Unaudited Financial Results For the Quarter & Half Year Ended 30th September, 2022 [Regulation 47(1)(h) of the SERI (LODE ) Regulations, 2015]

							(Rs. in lakhs)	
S.	Particulars	Quarter ended			Half Year Ended		Year Ended	
No.		30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2022	
		Unaudited			Unaudited		Audited	
1	Total income from operations	24,920.51	21,308.81	8,641.30	46,229.32	15,374.37	49,174.80	
2	Net profit / (loss) for the period (before tax, exceptional and extraordinary items)	4,641.12	4,060.42	1,325.35	8,701.54	2,506.40	8,117.87	
3	Net profit / (loss) for the period before tax (after exceptional and extraordinary items)	4,641.12	4,060.42	1,325.35	8,701.54	2,506.40	8,117.87	
4	Net profit / (loss) for the period after tax (after exceptional and extraordinary items)	3,255.09	2,866.59	928.71	6,121.68	1,757.41	5,702.04	
5	Total comprehensive income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	3,255.09	2,866.59	928.71	6,121.68	1,757.41	5,705.23	
6	Equity share capital	2,190.67	2,190.67	2,190.67	2,190.67	2,190.67	2,190.67	
7	Other equity (Reserves)				24,353.19		18,341.04	
8	Earning per share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) (not annualised)							
	1. Basic	14.86	13.09	4.24	27.94	8.02	26.03	
	2. Diluted	14.86	13.09	4.24	27.94	8.02	26.03	

Note:

a) The above unaudited financial results of the company for the Quarter & Half Year ended September 30th 2022 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 3rd November 2022. The

same have been subjected to limited review by the Statutory Auditors. The above financial results are prepared in accordance with Indian Accounting Standards ('IND AS') as prescribed under ] section 133 of the companies Act, 2013 read with relevant rules issued there under.

The above is an extract of the detailed financial results for the Quater & Half Year Ended 30th September, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations , 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchange www.nseindia.com and Company's website www.mbapl.com

For and on behalf of the Board of Directors

(Sourabh Gupta) CFO DIN 07177647



### TATVA CHINTAN PHARMA CHEM LIMITED

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) CIN: L24232GJ1996PLC029894

Registered Office: Plot No. 502 / 17, GIDC Estate, Ankleshwar, Dist. Bharuch, Gujarat - 393 002

Website: www.tatvachintan.com E-mail: cs@tatvachintan.com Tel. No.: +91 75748 48533 EXTRACT OF CONSOLIDATED STATEMENT OF FINANCIAL RESULTS

(Currency: Indian Rupees in Million, except per share d							er snare data
Sr.	Particulars	Quarter ended			Half year ended		Year ended
No.		30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)
1.	Total income from operations	900.91	884.02	1,236.15	1,784.93	2,304.47	4,336.47
2.	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	90.58	136.95	354.17	227.52	596.78	1,041.21
3.	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	90.58	136.95	354.17	227.52	596.78	1,041.21
4.	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	71.12	97.97	324.12	169.08	555.58	958.74
5.	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	73.76	99.00	323.38	172.75	554.58	960.27
6.	Equity share capital	221.65	221.65	221.65	221.65	221.65	221.65
7.	Reserves (excluding revaluation reserve) as shown in the audited balance sheet of the previous year		22000010				4,509.24
8.	Earnings per share (of Rs. 10/- each) (not annualised) - Basic: - Diluted:	3.21 3.21	4.42 4.42	15.02 15.02	7.63 7.63	26.66 26.66	44.59 44.59

#### FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2022 (Currency: Indian Rupees in Million) Half year ended Sr. Quarter ended Year ended No. 30.09.2022 30.09.2021 30.09.2022 30.09.2021 31.03.2022 **Particulars** 30.06.2022 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) Total income from operations 1,701.03 4,278.11 840.38 860.65 1,166.89 2,243.39 Net profit before tax 68.14 335.52 187.89 585.31 1,032.66 119.76 Net profit after tax 52.56 85.00 307.18 137.55 546.74 959.87 Total comprehensive income 84.57 306.72 136.69 958.42 52.13 545.20

Notes: a) The Consolidated & Standalone Financial Results for the quarter and half year ended 30 September 2022, were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 04 November 2022, which have been subjected to limited review by the statutory auditors of the Company, who has expressed unmodified opinion.

 b) The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended 30 September 2022, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended. The full format of Financial Results for the quarter and half year ended 30 September 2022, are available on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and also on the Company's website at www.tatvachintan.com

 Figures for the previous periods/year have been re-classified / re-arranged / re-grouped to conform to classification of current period, wherever necessary. For and on behalf of the Board of Directors of Tatva Chintan Pharma Chem Limited Sd/-

> **Chairman and Managing Director** DIN: 00183618

financialexp.epapr.in

Place: Bhilwara

Date: 3rd November .2022

Place: Vadodara, Gujarat, India.

Date: 04 November 2022

Ahmedabad

Chintan N. Shah

# પશ્ચિમ રેલવે મુંબઇ સેન્ટ્રલ-ભુજ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવશે

વેસ્ટર્ન રેલ્વે વચ્ચે ખાસ ટ્રેનો ચલાવવા માટે મુંબઈ સેન્ટ્રલ - ભુજ અને બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર મુસાફરોની સૂવિધા માટે અને પેસેન્જર ટ્રાફ્કિના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ -ભુજ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટેનો ચલાવશે

સુમિત ઠાકુર - ચીફ પબ્લિક રિલેશન્સ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ પશ્ચિમ રેલવેના અધિકારી, ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર ૦૯૪૨૩/ ૦૯૪૨૪ મુંબઈ સેન્ટ્રલ - ભુજ સ્પેશિયલ ૨ દ્રિપ્સ દ્રેન નંબર ૦૯૪૨૩ મુંબઈ સેન્ટ્લ - ભુજ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે શનિવાર. ૫ મી નવેમ્બર. ૨૦૨૨ ના રોજ ૨૨.૫૦ વાગ્યે અને બીજા દિવસે ૧૪.૧૫ કલાકે ભુજ પહોંચો. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૪૨૪ ભુજ -મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવારે

ભુજથી ઉપડશે, કમી નવેમ્બર, દિવસે ૧૬.૦૦ કલાકે બાંદ્રા ટર્મિનસ રંગ્રુરના રોજ ૧૫.૫૦ કલાકે અને ૦૬.૪૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચો, આગામી દિવસ માર્ગમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામખિયાળી ખાતે ઉભી રહેશે અને ગાંધીધામ સ્ટેશન બંને દિશામાં. આ ટેનમાં એસી કર્સ્ટ ક્લાસ, એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ. મુસાફરો કૃપા કરીને તે ન લે આ ટ્રેનમાં લિનન આપવામાં આવશે નહીં. ટ્રેન નંબર ૦૫૦૫૪/૦૫૦૫૩ બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર ખાસ ર પ્રવાસો ટ્રેન નંબર ૦૫૦૫૪ બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી આ દિવસે ઉપડશે ગુર્વાર, ૧૦ મી નવેમ્બર, ૨૦૨૨ ૧૭.૧૫ વાગ્યે અને શનિવારે ૦૬.૨૫ વાગ્યે ગોરખપુર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૫૦૫૩ બુધવાર, ૯મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ ગોરખપુરથી ઉપડશે. ૪.૧૦ કલાકે અને બીજા

પહોંચો. રસ્તામાં આ ટ્રેન થોભશે બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, આઈશબાગ, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશન બંને દિશામાં. આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી ૨-ટાયર, એસીનો સમાવેશ થાય છે ૩-ટાયર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ. ટ્રેન નંબર ૦૯૪૨૩ માટે બૃકિંગ ફળા; ૦૯૪૨૪ ૫મી નવેમ્બર, ૨૦૨૨થી અને ટ્રેન માટે ખુલશે નંબર ૦૫૦૫૪ ૭મી નવેમ્બર, ૨૦૨૨થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કરી શકે છે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.

#### રાજનીતિના સૌથી મોટા સમાચાર

# કોઇ પણ સિટિંગ એમપી કે એમએલએના सगाने नहीं अपाय: मनसुज पसापा

ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વર્તમાન ધારાસભ્યો અને સાંસદોના સગાઓને ટિકિટ નહીં આપે.

ભાજપ વર્તમાન ધારાસભ્યો અને સાંસદોના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને ટિકિટ નહીં આપે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી છે તેમાં પક્ષના આ નિર્ણયની જાણકારી આપી છે. મનસૂખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ચાલુ MP-MLAના પરિવારને ટિકિટ નહીં આપવાનો ભાજપનો હા...ભાજપ વર્તમાન ધારાસભ્યો-

ભરૂચ,તા.૪ નિર્ણય છે તે આવકારું છે અને અમે ગુજરાતમાં વિધાનસભાની જે પણ ઉમેદવાર આવશે તેને

> મનસુખ વસાવાએ પોતાની દીકરી પ્રીતિ વસાવા માટે ટિકિટ માગી હતી. પરંતુ પક્ષે નિર્ણય કર્યો છે કે જેટલા પણ સિટિંગ ધારાસભ્યો અને સાંસદો છે તેમના સગાઓને આ વખતે ભાજપ ટિકિટ નહીં આપે, એટલે કે ગુજરાતના ૨૬ સાંસદોના પરિવારજનોને ટિકિટ

રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના જે આઠ સાંસદો છે તેમાંથી ૭ ગુજરાતી ધારાસભ્યોના પરિવારને ટિકિટ નહીં મળે. જી

સાંસદોના સગાને ટિકિટ નહીં

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપેલી જાશકારી પ્રમાણે ભાજપના વર્તમાન ૧૧૧ ધારાસભ્યોના પરિજનોને પણ ટિકિટ નહીં મળે. કેમ કે, પાર્ટીએ નિર્ણય કર્યો છે કે વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના પરિજનોને ટિકિટ આપવાની નથી. મનસુખ વસાવાએ પોતાની દીકરી પ્રીતિ વસાવા માટે ટિકિટ માગી હતી પરંતુ પાર્ટીએ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે તે અંગે વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાશકારી આપી છે અને પક્ષના આ નિર્ણયને આવકાર્યો છે.

### ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની

# રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાદનોનું બારીકાઇથી ચેકીંગ

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠાને જોડતી, પોલીસ દ્વારા રાજસ્થાનની તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયુ છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરી

ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસે ચેકિંગમાં જોડાયા હતા. તો એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન રાજસ્થાનથી આવતા વાહનોના તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના ૭ મુખ્ય માર્ગો અને અન્ય ૨૩ નાના માર્ગો સહિત ૩૦ માર્ગો ઉપર ત્યારે આ વખતે કોઈ બુલટેગરો

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી

ઈમરાન ખાન પર હુમલો કરનારા

વ્યક્તિના કબૂલાતનામાવાળો

વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે.

જોવામાં ફેંઝલ ભક સામાન્ય

નાગરિક જેવો લાગે છે. તેનું કહેવું છે

કે તેણે ઈમરાન ખાન પર એટલા માટે

હુમલો કર્યો કારણ કે પીટીઆઈ

આઝાદી માર્ચ દરમિયાન મોટા

અવાજે ગીતો વગાડી રહ્યા હતા અને

તેનાથી અજાનમાં ખલેલ પડતી

હતી. અત્રે જણાવવાનું કે ગુરુવાર

એટલે કે ૩ નવેમ્બરના રોજ

ચેકીંગ કરાઈ રહ્યું છે.

બનાસકાંઠા એસપી અક્ષય મકવાણા આજે રાજસ્થાન ગુજરાતને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા અને તેમની ટીમે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું બારીકાઈથી ચેકીંગ હાથ ધર્યું હતું. બનાસકાંઠા પોલીસ સહિત આઇટીબીપીના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલ હાલતમાં છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે ચેકપોસ્ટ ઉભી કરી કરાઈ છે. તેમજ સિક્રય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે

આઝાદી માર્ચમાં ઇમરાન ખાન પર હુમલો

ફાયરીંગ કરનારા શખ્સે શું કહ્યું તે ખાસ જાણો

ઇસ્લામાબાદ,તા.૦૪ પાકિસ્તાનના ગુજરાંવાલાના અલ્લાહવાલા ચોક પર

અંતરાત્માને ગમી નહીં.

પીટીઆઈના ચેરમેન ઈમરાન ખાન પર હુમલો થયો

હતો. ઈમરાન ખાનની આઝાદી માર્ચનો કાફલો

ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ

હુમલો થયો હતો. ત્યારે ફૈઝલ ભક્ટે ઈમરાન ખાન પર

ફાયરિંગ કર્યું હતું. જો કે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને

પકડી લીધો. જો કે ત્યાં સુધીમાં તો તે ફાયરિંગ કરી

ચૂક્યો હતો. પાકિસ્તાની મીડિયા મુજબ આ હુમલામાં

ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી. ત્યારબાદ તેના

સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. ઈમરાન ખાન પર

હુમલો કરનારા વ્યક્તિએ પોતાના કબૂલાતનામામાં જે

કહ્યું તે જાણીને વિચિત્ર લાગે. તેણે કહ્યું કે એકબાજુ અજાન

થઈ રહી હતી અને બીજી બાજુ આ લોકો ડેક (ઓડિયો

સિસ્ટમ) લગાવીને શોર કરી રહ્યા હતા. આ ચીજ મારા

બનાસકાંઠા ,તા.૪ રાજસ્થાન તરફથી તમામ વાહનોનું તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. તો બીજી તરફ, મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીનુ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું

કે, સરકાર બનાવવી હોય તો બહુમતી જોઈએ. આમ આદમી પાર્ટીનું ખાતું નહી ખૂલે અને મુખ્યમંત્રીના નામ જાહેર કરે છે. કોંગ્રેસની જીત નક્કી છે, અમારી સરકાર બનશે. તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે ભરતસિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અબજોપતિ છે. કોંગ્રેસની વિચારધારા સાથે આપના કોઈ કાર્યકર જોડાય તો આવકારીશું તે વાત હતી, પરંતું કોંગ્રેસ આમ આ<u>દમી પાર્ટી સા</u>થે કોઈ ગઠબંધન નહીં

<u>જાહેર ચેતવણી</u>

#### (૧) ભાવના ટી. અરોઠે તથા (૨) તુષાર બી. અરોઠે રહે. ૩૦૨, જે-૧ અપાર્ટમેન્ટ, પ્લોટ નં ૨૫/એ, રોઝરી સ્કુલ સામે, પ્રતાપર્ગંજ, વડોદરાના ઓ તે આ જાહેર ચેતવણી આપી જણાવીએ છીએ કે, અમારો પુત્ર નામે ''ઋષિ'' આશરે ઘણા લાંબા સમયથી અમારા કહ્યામાં નથી અને ઘર છોડીને અમારાથી અલગ થઇ મનસ્વી રીતે પોતાનુ જીવન જીવી રહેલ છે. આથી અમો બન્નેવ ભાવના તથા તુષાર તે અમારા પુત્રને અમારી માલીકીની તમામ પ્રકારની સ્થાવર તેમજ જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની સ્થાવર તેમજ જંગમ મિલકતોમાં તેનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો વિગેરે રહેશે નહી. વધ્માં તેને પાછલા વર્ષો દરમ્યાન કે ભવિષ્યમાં કોઇપણ વ્યક્તિ કે અન્ય કોઇ પણ સંસ્થા, બેંક, સરકારી બેંક, અર્ધ સરકારી બેંક કે કોઇ ઓથોરીટી પાસે કોઇપણ પ્રકારનો વહીવટ, વ્યવહાર કે લખાણો કરેલ હશે કે કરશે તો તે માટે અમો નીચે સહી કરનારની કોઇપણ પ્રકારની જવાબદારી રહેશે નહી કે, અમારા હક્ક હિતને બંધનકર્તા રહેશે નહી. આમ, છતા કોઇ વ્યક્તિ કે કોઇપણ આવા પ્રકારના વ્યવહાર કે વહીવટ અમારા પુત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓ એટલે કે વ્યવહાર વહીવટ કરનાર જે-તે પક્ષકારોની રહેશે અને તેમાં અમો આ જાહેર ચેતવણી આપનારની કોઇ જવાબદારી રહેશે નહી કે, અમારા કોઇ હક્ક હિતને બંધનકર્તા રહેશે નહી. જેની તમામ જાહેર જનતાએ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવી. વધુમાં તેના વ્યવહારો બાબતે અમોને હેરાન

તા.0४/૧૧/૨૦૨૨ વડોદરા.

અસીલની સુચના અને ફરમાશથી ઉમંગ પી. ગુમે (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ)

પ્રી-કોવિડ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેની

## १००% देनोमां सिनन सिस्टम पुनःस्थापित

વડોદરા,તા.૪ મુસાકરોની સુવિધા માટે કોવિડ પહેલાના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વેએ તમામ ૧૩૯ જોડી ટ્રેનોમાં એટલે કે તેની ૧૦૦% ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરી છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ ભારતીય રેલ્વે દ્વારા મુસાકરોની મુસાકરી દરમિયાન કોવિડ-૧૯ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અને કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જો કે,

થોડા મહિના પહેલા સેવાઓ સામાન્ય થઈ ગઈ હતી.

અને આ પ્રતિબંધ હટાવવાની સાથે, પશ્ચિમ રેલવેએ તબક્કાવાર નામાંકિત ટેનોમાં લીનન જોગવાઈ પુનઃસ્થાપિત કરવાનું શરૂ કર્યું. ઠાકુરે માહિતી આપી હતી કે લિનનની યોગ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લિનન (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો હતો.. કારણ કે નવા લીનન મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી રહી હતી. ટ્રેનોની યાદી પરિશિષ્ટ તરીકે

ગક્કર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક

ગક્કર દ્વારા દિગ્દર્શિત, 'વ્હાલમ જાઓ ને'

TATVA CHINTAN

## બહુ જ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ व्हालभ काओने थियेटरमां रक्ष

🔳 અહીં પાંચ કારણો છે. જે કેમિલી છે. બે સફળ હિન્દી ફિલ્મો બાદ,દિગ્દર્શક એન્ટરટેનરને મસ્ટ-વોચ બનાવે છે! ૧) હાર્દિક ગજ્જરે ગુજરાતી સિનેમામાં પ્રવેશ 'વ્હાલમ જાઓ ને' ફિલ્મને તેનું શીર્ષક કર્યો. હાર્દિકની સેન્સ ઑફ હ્યુમર ખૂબ જ કેવી રીતે મળ્યું! વ્હાલમ જાઓ ને' સારી છે અને તેઓ એક સંપૂર્ણ એન્ટરટેનર પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની બનાવવાનું વિચારી રહ્યા હતા. પરફેક્ટ એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય ફેમિલી કોમેડી માટેની તેમની શોધનો અંત કલાકારોના પાત્રાલેખન અને તેમના આવ્યો,જ્યારે તેમણે 'વ્હાલમ જાઓ ને'ની લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે સ્ક્રિપ્ટ સાંભળી અને પ્રતિક ગાંધી કે જેમની અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સાથે તેઓ ઘનિષ્ઠ મિત્રતા ધરાવે તેમને સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની પોતાની સાથે લીધા અને એકસાથેત્રીજી વિચાર પ્રક્રિયાને એક પંક્તિમાં પ્રતિબિંબિત ફિલ્મ ચિદ્ધિત કરી.૫) મ્યુઝિક આ ફેમિલી કરે છે. ૨) ગુજરાતી સિનેમાના ૧૦ એન્ટરટેઇનરમાં 'તડકો' ઉમેરે છે! ફિલ્મમાં દિગ્ગજ કલાકારો! 'વ્હાલમ જાઓ ને'એક સફળ જોડી સચિન-જીગર દ્વારા સંગીત સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે અને પ્રથમ આપવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને વખત ગુજરાતી ફિલ્મ અને થિયેટર ગુજરાતી સિનેમાં માટે અનેક હિટ ટ્રેક ઉદ્યોગના ૧૦ દિગ્ગજ કલાકારો એક સાથે કમ્પોઝ કર્યા છે. સચિન-જીગરે ફિલ્મના આવ્યા છે; દરેક પાત્ર વિશેષ છે અને મૂડને યોગ્ય રીતે વર્ણવતી અસાધારણ તેમની પડકારજનક ભૂમિકાઓને સૌથી પ્રસ્તૃતિઓને કંપોઝ કરી છે. 'વ્હાલમ યથાર્થ રીતે રજૂ કરી છે, એક સંપૂર્ણ કોમેડી જાઓ ને'ના ગીતો મધુર, ભાવપૂર્ણ અને જે દરેકને પેટ પકડીને હસાવવાની ખાતરી મનોરંજક છે અને ફિલ્મના મૂડને સંપૂર્ણ આપે છે. 'વ્હાલમ જાઓ ને' દિગ્ગજોમાં રીતે કેપ્ચર કરે છે.'ચોરી લઉ' એ એક - પ્રતિક ગાંધી, દીક્ષા જોષી સાથે ટીક્ ઇન્ટેન્સ રોમેન્ટિક સોન્ગ છે, જે તમારા હૃદય તલસાણિયા, સંજય ગોરાડિયા, જયેશ અને આત્માના ઊંડાણમાં પ્રવેશી જાય છે, મોરે. ઓજસ રાવલ, કવિન દવે, કિંજલ તો બીજી તરફ 'મુરતીયો મૂડમાં નથી' પંડ્યા, બિંદા રાવલ અને પ્રતાપ સચદેવ પરિવારોને ડાન્સ ક્લોર પર ખેંચી લાવવાનું શામેલ છે. ૩) પ્રતિક ગાંધી ફરી પોતાના વચન આપતું પરફેક્ટ વેડિંગ સોન્ગ છે.આ મૂળ તરફ! પ્રતિક ગાંધી લગભગ ત્રણ વર્ષના ગીત એ તમામ છોકરાઓ માટેનું એક લાંબા ગાળા પછી ગુજરાતી ફિલ્મમાં જોવા એન્થમ છે, જેઓને કોઈ કારણોસર લગ્ન મળશે. જે તેમના સ્થાનિક ચાહકો માટે કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં એક મોટી ટીટ છે! 'વ્હાલમ જાઓ ને'માં છે! વ્હાલમ જાઓ ને' ગુજરાતી સિનેમામાં પ્રતિક એક સંગીતકારની ભુમિકા ભજવે જિયોસ્ટુડિયોની આગેકૂચને ચિક્તિત કરે છે. છે અને રણવીર સિંહની સ્ટાઈલિસ્ટ બનવા આ ખૂબ જ પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટનું માંગતી એક શ્રીમંત એનઆરઆઈ પીઠબળ ધરાવતી ટ્વીસ્ટ્સ એન્ડ ટર્ન્સ ઉદ્યોગપતિની ફેશન ડિઝાઇનર પુત્રી દીક્ષા સાથેની મલ્ટી-સ્ટારર રોલર કોસ્ટર કોમેડીને જોશીના પ્રેમમાં પડે છે. ૪) ં આ એક થિયેટરોમાં જોવી જ જોઈએ, જેનો પ્રારંભ હેરિક છે! 'વ્હાલમ જાઓ ને' પ્રતિક ગાંધી કરવાની શ્રેષ્ઠ રીત બીજી શું હોઇ શકે છે! અને હાર્દિક ગક્કરની એકસાથે ત્રીજી ફિલ્મ જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટ્રુડિયો અને હાર્દિક

#### આકાશ ફાઇટર પ્લેનના અવાજથી ગૂંજી ઉઠ્યું, શનિવારે એરફોર્સના કરતબો નિહાળશે

વડોદરા,તા.૪ શહેરના દરજીપરા એરફોર્સ સ્ટેશન ખાતે આવતીકાલ શનિવારે એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે સૂર્યીકરણ વિમાનો વડોદરા આવી પહોંચ્યા હતા અને રિહર્સલ કર્યું હતું. જેથી સમગ્ર શહેર ફાઇટર પ્લેનના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. ભારતીય હવાઇ દળના સૂર્યકિરણ ટીમના પાયલોટો પોતાના વિમાનો સાથે શનિવારને બપોરે ૩ વાગ્યા થી ૪:૩૦ વાગ્યા દરમિયાન એર શો નું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વડોદરાનું આકાશમાં લોકો ફાઇટર વિમાનોના કરતબો જોઇ શકશે. એર શો પહેલા આજે સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનુ રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘેખનીય છે કે આ પહેલા વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં સૂર્યકિરણ ટીમ વડોદરા આવી હતી અને લોકો એર શો નિહાળ્યો હતો. નોંધનીય છે કે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. તેની સ્થાપના ૧૯૯૬માં થઈ હતી. શરૂઆતમાં આ ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ વિમાનો સાથે ૨૦૧૧ સુધી એર શો કરતી હતી. સૂર્યીકરણ ટીમને ૨૦૧૧ બાદ વિખેરી નાંખવામાં આવી હતી અને ૨૦૧૭માં તેનુ કરી ગઠન કરવામાં આવ્યુ હતુ .

આથી સર્વને આ જાહેર ચેતવણી આપતા જણાવવાનું કે, આથી અમો નીચે સહી કરનાર પરેશાન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો.

સરનામુ : ૬૯, ઉષાનગર સોસાયટી, ઇ.એસ.આઇ હોસ્પીટલ પાછળ, ગોત્રી રોડ-વડોદરા-૨૧. મો. ૮૬૯૦૭૩૨૮૩૩

Place: Vadodara, Gujarat, India

Date: 04 November 2022

મહારાષ્ટ્ર રેલવે પોલીસે સરપંચોને પાઠવી નોટીસ

# રેલવે ટ્રેક પર જો ઢોર રખડતા डार्चवाही

છેલ્લા ઘણા સમયથી વંદે ભારત ટ્રેનને એક પછી એક રખડતા ઢોર ટકરાવાનાં બનાવો પ્રકાશમાં આવ્યા છે. જે બનાવ બાદ રેલ્વે પોલીસ સતર્ક બની જવા પામી છે. ત્યારે રેલ્વે સુરક્ષા કર્મીઓએ મહારાષ્ટ્રનાં પાલઘરમાં રેલ્વે માર્ગમાં આવતા ગામડાનાં સરપંચોને નોટિસ ફટકારવાનું શરુ કરી દીધું છે અને નોટિસમાં ઉલ્લેખ પણ કર્યા છે કે રખડટા ઢોરોને રેલ્વેનાં પાટા પર ન જવા દેવાનું શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું. તેમજ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો રખડતા ઢોરોનાં માલિકોની બેદરકારીના કારણે કોઈ રખડતા ઢોર રેલ્વેના પાટા પર જશે તો તે પશુ માલીક સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ સપ્ટેમ્બરના રોજ

ગુજરાત અને મુંબઈ વચ્ચે સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરી હતી.તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ ઘટનાઓ બની છે જેમાં ટ્રેન ઢોર સાથે અથડાઈ હતી.પશ્ચિમ રેલ્વેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આરપીએફના મુંબઈ વિભાગ દ્વારા ગામના સરપંચોને નોટિસ આપવામાં આવી રહી છે, જેમાં અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને અપીલ કરી છે કે તેઓ તેમના ઢોરોને પાટા પાસે ન જવા દે, જેથી આવા અકસ્માતો થઈ શકે. ટાળ્યુંઠાકુરે જણાવ્યું હતું કે સરપંચોને આપવામાં આવેલી નોટિસો નિવારક પ્રકૃતિની છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પશુઓ અથડાયા હતા.ટ્રેન સેવા શરૂ થયા બાદ આ ત્રીજી ઘટના હતી.અગાઉ ૬ અને ૭ ઓક્ટોબરે પણ કેટલાક પશુઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.આ બંને ઘટનાઓ ગુજરાતમાં બની છે.આ તમામ ઘટનાઓમાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી.જોકે, ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.ઠાકુરે કહ્યું, ×આવી ઘટનાઓએ રેલ કામગીરીને પ્રતિકૂળ અસર કરી છે.આવી ઘટનાઓને કારણે ટ્રેન અકસ્માત અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શક્યતા વધી ગઈ છે.આના કારણે રેલ વ્યવહારમાં વિક્ષેપ પડે છે અને રેલ્વે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ મુસાફરો માટે જોખમ પણ ઉભું થાય છે.પરંતુ તેના કારણે હંમેશા મોટા અકસ્માતો થવાની સંભાવના રહે છે.ઠાકુરે કહ્યું ×આરપીએફએ આ વર્ષે અત્યાર સુધીમાં જોખમી સ્થળોએ ૧,૦૨૩ જાગૃતિ અભિયાન ચલાવ્યા છે.

### સીદી સમૃદાચના લોકો ઉત્સાહભેર લોકશાહીના પર્વના ભાગીદાર બનશે

## ઇતિહાસમાં પહેલીવાર ગીરના સીદીઓ માટે 3 અલગ વોટિંગ બૂથ બનાવાશે

ગીર સોમનાથ જિલ્લામાં વસતા ૩,૪૮૧ સીદી સમાજના મતદારો માટે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરાશે. આ બુથ વિવિધતામાં એકતા અને ભારતીય લોકશાહીની શક્તિના સાક્ષી આપનાર બનશે.સદીઓ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા મજૂરી કામ માટે ગુલામ તરીકે લવાયેલા આફ્રિકન પ્રજાતિના લોકો વર્ષો બાદ હવે પૂર્શતઃ ભારતીય બન્યા છે. ભાષા અને રહેણીકરણીથી લઈને મતાધિકાર સુધી તેઓ ભારતીય છે. ભારતીયતા તેઓની રગેરગમાં ઝળકે છે. અંદાજે ૧૫ મી સદી બાદ જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે ગુલામો તરીકે કેટલાક આફ્રિકન લોકોને લાવવામાં આવ્યા હતા. ઉપરકોટના કપરા ચઢાણમાં પણ આફ્રિકન પ્રજાતિના આ લોકોએ

ટનનો વજન ઉપર ચઢાવ્યા હતા. જેને પ્રક્રિયામાં વિશેષ સન્માન આપ્યું છે. કારણે ઉપરકોટનો કિલ્લો બન્યો હતો. કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ જુનાગઢના રાજાએ તેમને વસવાટ આપ્યો હતો. નવાબે તેમને ગીર જંગલની મધ્યમાં જાંબુર નામનું નાનું એવું ગામ આપ્યું, જ્યાં આ પ્રજાતિ વસી હતી. પહેલા એવુ લાગ્યુ હતું કે, સિંહો આ પ્રજાતિને ખાઈ અને ખતમ કરી દેશે. પરંતુ આફ્રિકામાં સિંહો સાથે ઉછરેલી આ પ્રજાતિ એશિયાઈ સિંહોને જોઈને વધુ ઉત્સાહિત થઈ. તેમને થયું કે પોતે વતન પહોંચી ગયા. અને આ રીતે સદીઓથી તેઓ ગીરના જાંબુર ગામમાં વસ્યા છે. સીદી સમાજ એ ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો આફ્રિકી ભારતીય સીદી સમાજનું ધમાલ નૃત્ય જોવાનું અચૂક પસંદ કરે છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતના અભિક્ષ અંગ પરંતુ ભૃપૃષ્ઠ અને લાક્ષણિકતાની

પહેલીવાર સીધી સમુદાય માટે જાંબુર અને માધુપુર ગામે ત્રણ વિશેષ બુથ તૈયાર કરવામાં આવશે. કુલ ૩૪૮૧ સીદી સમાજના મતદારો પોતાના માટે ખાસ બનેલા બૂથમાં મતદાન કરશે અને પોતાની ભારતીયતાનો ગૌરવ લેશે. ત્યારે આ નિર્ણય પર સીદી સમાજના અગ્રણી હાસમ મુસાગરાએ ખુશી વ્યક્ત કરી હતી.

મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં ભણ્યા અને બેરિસ્ટર તરીકે ત્યાં સેવા પણ આપી. પોતાનો પ્રથમ સત્યાગ્રહ અને પ્રથમ આશ્રમ પણ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યા હતા. ત્યારે ભારત અને આફ્રિકાની મિત્રતા તેમજ મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્વરૂપે ગીર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વિશેષ બૃથ બનાવવામાં આવશે. લોકશાહીની સુંદરતા અને વૈવિધ્યતાના ઉદાહરણ રૂપ બનશે તેવુ ગીરસોમનાથના કલેક્ટર

#### TATVA CHINTAN PHARMA CHEM LIMITED

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) CIN: L24232GJ1996PLC029894

Registered Office: Plot No. 502 / 17, GIDC Estate, Ankleshwar, Dist. Bharuch, Gujarat - 393 002

Website: www.tatvachintan.com E-mail: cs@tatvachintan.com Tel. No.: +91 75748 48533 **EXTRACT OF CONSOLIDATED STATEMENT OF FINANCIAL RESULTS** 

				(Currency: Ir	ndian Rupees in	Million, except p	er share data	
Sr. No.	Particulars	Quarter ended			Half year ended		Year ended	
		30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)	
1.	Total income from operations	900.91	884.02	1,236.15	1,784.93	2,304.47	4,336.47	
2.	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	90.58	136.95	354.17	227.52	596.78	1,041.21	
3.	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	90.58	136.95	354.17	227.52	596.78	1,041.21	
4.	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	71.12	97.97	324.12	169.08	555.58	958.74	
5.	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	73.76	99.00	323.38	172.75	554.58	960.27	
6.	Equity share capital	221.65	221.65	221.65	221.65	221.65	221.65	
7.	Reserves (excluding revaluation reserve) as shown in the audited balance sheet of the previous year						4,509.24	
8.	Earnings per share (of Rs. 10/- each) (not annualised) - Basic: - Diluted:	3.21 3.21	4.42 4.42	15.02 15.02	7.63 7.63	26.66 26.66	44.59 44.59	

	FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2022								
	(Currency: Indian Rupees in Million)								
Sr.		Quarter ended			Half year ended		Year ended		
No.	Particulars	30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)		
1.	Total income from operations	840.38	860.65	1,166.89	1,701.03	2,243.39	4,278.11		
2.	Net profit before tax	68.14	119.76	335.52	187.89	585.31	1,032.66		
3.	Net profit after tax	52.56	85.00	307.18	137.55	546.74	959.87		
4.	Total comprehensive income	52.13	84.57	306.72	136.69	545.20	958.42		
Not	Notes:								

**KEY NUMBERS OF STANDALONE STATEMENT OF FINANCIAL RESULTS** 

a) The Consolidated & Standalone Financial Results for the quarter and half year ended 30 September 2022, were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 04 November 2022, which have been subjected to limited review by the statutory auditors of the Company, who has expressed unmodified opinion.

The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended 30 September 2022, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended. The full format of Financial Results for the quarter and half year ended 30 September 2022, are available on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and also on the Company's website at www.tatvachintan.com.

Figures for the previous periods/year have been re-classified / re-arranged / re-grouped to conform to classification of current period, wherever necessary. For and on behalf of the Board of Directors of

Tatva Chintan Pharma Chem Limited

Chintan N. Shah **Chairman and Managing Director** DIN: 00183618